

June 26, 2021

To,
Corporate Relationship Department
BSE Limited,
14th Floor, P. J. Towers,
Dalal Street, Fort,
Mumbai-400001
SCRIP CODE: 532779

To,
Listing Department
National Stock Exchange of India Limited
“Exchange Plaza”, C – 1, Block G
Bandra- Kurla Complex, Bandra (East),
Mumbai-400051
SCRIP SYMBOL: TORNTPOWER

Dear Sir/ Madam,

Subject: Newspaper Advertisement of Notice to Shareholders

Pursuant to Regulation 30 read with Para A of Part A of Schedule III and Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copy of newspaper advertisements published on June 25, 2021 in “The Financial Express” in English (All India Edition) and Gujarati (Ahmedabad Edition), intimating the Members’ about Deduction of Tax at Source on Final Dividend for FY 2020-21, which is subject to approval of the Members’ at the ensuing Annual General Meeting.

The communication on deduction of Tax at Source on Dividend is also available on the website of the Company at the following link:

<https://www.torrentpower.com/pdf/download/CommunicationtoShareholderTaxonFinalDividend.pdf>.

You are requested to take note of the same.

Thanking you,

Yours faithfully,

For Torrent Power Limited

Rahul Shah
Company Secretary & Compliance Officer

GUJARAT CHIEF MINISTER Vijay Rupani has approved development of a greenfield port at Nargol in south Gujarat through the public-private-partnership with an extended build, own, operate

Gujarat govt okays development of greenfield port at Nargol

and transfer (BOOT) period of 50 years.

As port projects have huge gestation lags, the Gujarat government is setting a prece-

dent by keeping the initial BOOT period for Nargol port development at 50 years, rather than 30 years usually offered for greenfield port

development in the state.

This presents the potential developer with an assurance for greater return on investment. The proposal also offers

interested developers the flexibility to quote discounted waterfront royalty rate, in addition to the prevailing system of quoting premium on the base rates.

—FE BUREAU

After two years, Modi assures top J&K leaders of polls first, statehood later

DEEPTIMAN TIWARY
New Delhi, June 24

IN HIS FIRST direct political engagement with leaders of Jammu and Kashmir in almost two years, Prime Minister Narendra Modi Thursday assured them his government was committed to kick-starting the democratic process through Assembly elections as soon as possible.

Separately, Union Home Minister Amit Shah said the Centre was bound by its assurances on elections and statehood to J&K. He also promised a review of detentions through a committee under Lieutenant Governor Manoj Sinha.

The meeting was attended by 14 political leaders — former Chief Ministers (Farooq Abdullah - National Conference, Ghulam Nabi Azad - Congress, Mehbooba Mufti - PDP, Omar Abdullah - NC), former Deputy CMs and heads of all parties in J&K.

The meeting lasted three-and-a-half hours and each political leader spoke without any reservations. The Prime Minis-



PM Narendra Modi, home minister Amit Shah and L-G Manoj Sinha with J&K leaders ahead of the talks on Thursday

ter told them he wanted to meet them earlier, but could not due to Covid-19. He was keen that the exercise of the Delimitation Commission be completed at the earliest so that elections could be held soon.

"The consensus was that the democratic system should be re-established in the region and the electoral process started. The PM said Assembly elections will happen after the delimitation process is completed. He sought cooperation from all parties in the delimitation process. On statehood, he said it will be given at the appropriate time," BJP leader and former Deputy CM of Jammu and Kashmir Nirmal Singh said.

While PDP praised the issue of Article 370 abrogation, other parties joined in on the demand for release of political leaders and youth under PSA. "On detentions, the Home Minister clarified that a wrong picture was being given that there are too many detainees. He gave data to show that numbers are not high. He also said that the LG will form a committee to review cases of all detainees," Nirmal Singh said.

Ghulam Nabi Azad of Congress said his party presented five key demands: early statehood, Vidhan Sabha elections at the earliest, guarantees to local people on government jobs, property and domiciles, rehabilitation of Kashmiri pandits, and release of all political prisoners. "On Article 370, most parties felt it would be appropriate to wait for the outcome of the case being heard in the Supreme Court," he said.

Apni Party's Altaf Bukhari said, "That the PM gave a patient hearing for over three hours is itself a big thing. He spoke about elections and the sought partic-

ipation of all parties. On statehood, he said it will happen in due course."

Those present in the meeting included Farooq Abdullah, Omar Abdullah, and Davinder Singh from the National Conference; Mehbooba Mufti and Muzaffar Hussain Baig from PDP; Sajjad Lone from People's Conference; MY Tarigami from CPM; Ghulam Nabi Azad, Ghulam Ahmed Mir and Tara Chand from Congress; Dr Jaetendra Singh, Nirmal Singh, Ravinder Raina and Kavinder Gupta from the BJP; Bhim Singh of Nationalist Panthers Party; Altaf Bukhari from Apni Party.

This was the first major outreach towards mainstream political parties in Jammu and Kashmir since abrogation of the erstwhile state's special status in 2019.

The Centre had last week contacted all key political leaders and invited them for a meeting with PM Narendra Modi. While no agenda had been set by the Centre officially, sources had said that the meeting was being called to consult the parties on the delimitation process in the union territory and starting the democratic process through an Assembly election later this year.

The parties had welcomed the move saying that it showed the Centre had acknowledged their importance in the region and that dialogue was the right process to deal with the situation in the region.

Leaders of the People's Alliance for Gupkar Declaration (PAGD), a coalition of mainstream parties in Jammu and Kashmir, announced Tuesday that they would be attending the meeting called by Prime Minister Narendra Modi in New Delhi on June 24.

India's engineering, research & development mkt to reach \$63 bn by 2025: Nasscom

PRESS TRUST OF INDIA
New Delhi, June 24

INDIA'S SHARE in the global engineering and research and development (ER&D) market is expected to grow at a compound annual growth rate (CAGR) of 12-13% to reach \$63 billion by 2025, according to industry body Nasscom.

Speaking at the Nasscom Engineering R&D Showcase 2021 event, Nasscom President Debjani Ghosh noted that the pandemic has altered the way consumers behave, interact with companies, and how businesses interact.

Contactless technologies, analytics, software-led systems are changing how products are designed, redesigned, engineered, and consumed, she added.

"...this represents a very unique opportunity for the ER&D companies in India that are primarily focusing on prod-

uct design and innovation to partner with global enterprises and engineer the future, global megatrends like sustainability, create even more opportunities for product redesign and innovation and that is going to be tremendously important for the future of this industry," Ghosh said.

She said India's share in the global engineering and research and development (ER&D) market is expected to grow at a CAGR of 12-13 per cent to reach USD 63 billion by 2025 from \$31 billion in 2019.

"This growth is being driven by global enterprises across automotive, aerospace, consumer electronics, medical devices, industrial and energy, semiconductor, telecom who are tapping into Indian ER&D's ability to power innovation, drive high impact service delivery by leveraging the think force of the future," she added.

TOURISM FINANCE CORPORATION OF INDIA LIMITED
(CIN L65910DL1989PLC034812)
Regd. Office: 4th Floor, Tower 1, NBCC Plaza, Sector V, Pushp Vihar, Saket, New Delhi-110 017. Phone: 011-29561180 Fax: 011-29561171
Email: complianceofficer@tfcilt.com, Website: www.tfcilt.com

Notice is hereby given to the Shareholders
(For transfer of unpaid/unclaimed dividend and equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Account)
Sub: (1) Reminder to claim the dividends remaining unpaid/unclaimed
(2) Transfer of unclaimed equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Account

NOTICE is hereby given pursuant to the provisions of the Companies Act, 2013 ("The Act") read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("The Rules") notified by the Ministry of Corporate Affairs (MCA), Government of India.

As per Section 124(5) of the Act, all dividends remaining unpaid or unclaimed for a period of seven years are required to be transferred by the Company to Investor Education and Protection Fund (IEPF). Unpaid or unclaimed dividend pertaining to all financial years upto and including FY 2012-13 have already been transferred to IEPF as required under the Act and rules thereof.

Section 124(6) of the Act read with the Rules requires that all shares, in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more (relevant shares), shall be transferred by the company in the name of IEPF along with statement containing such details as may be prescribed.

All shares in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more (relevant shares) upto and including 2012-13 have already been transferred by the Company in the name of IEPF and statement containing such details as prescribed is placed on Company's website www.tfcilt.com. The company has communicated individually via letter dated May 13, 2019, July 6, 2020, June 22, 2021 and also in all AGM/EGM notices to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF under the said Rules for taking appropriate action(s).

The full details of unpaid/unclaimed dividends of the Company are placed on its website www.tfcilt.com and that of the Ministry of Corporate Affairs (MCA), Government of India, as required under the Act and Rules made thereunder.

We request you to claim the dividends, if any, remaining unpaid to/unclaimed by you from the year 2013-14 onwards, by making an application immediately to Tourism Finance Corporation of India Limited, Registrars and Share Transfer Agents of the Company.

In case we do not receive your claim for the Dividends as aforesaid by **September 1, 2021** we shall with a view to comply with the requirements of the said Act and Rules, transfer the relevant shares to IEPF by following the procedures stipulated in the Rules in this regard, without any further notice. Shareholders may kindly note that subsequent to such transfer of relevant shares to IEPF, all future benefits which may accrue thereunder, including future dividends, if any, will be credited to IEPF.

Further, shareholders may kindly note that after the above referred transfer is made, refunds from the IEPF can be claimed only by complying with the provisions of Rule/ of the said rules. Please note that no claim shall lie against the Company with respect to the unclaimed dividends and share(s) transferred to the IEPF pursuant to the Rules.

In case the shareholders have any queries on the subject matter, they may contact the Company the Registered office (or email complianceofficer@tfcilt.com) or to our Registrar and Share Transfer Agent (Address: MCS Share Transfer Agent Limited Unit: TFCI Ltd, 1st Floor, F-65 Okhla Industrial Area, Phase-1, New Delhi-110020 or email atadmin@mcsregistrars.com or helpdeskdelhi@mcsregistrars.com)

For Tourism Finance Corporation of India Ltd.
Sd/-
(Sanjay Ahuja)
Company Secretary

Place: New Delhi
Date: 24.06.2021

के आई ओ सी एल लिमिटेड
KIOCL LIMITED
(A Government of India Enterprise)
CIN : L13100KA1976GOI002974
II Block, Koramangala, Bengaluru - 560 034
Tel: 080-25531525, Web- www.kioclldt.in, E-mail- cs@kioclldt.in

NOTICE TO SHAREHOLDERS FOR TRANSFER OF UNCLAIMED / UNPAID DIVIDEND & EQUITY SHARES THEREOF TO INVESTOR EDUCATION AND PROTECTION FUND AUTHORITY (IEPFA)

Notice is hereby given that pursuant to the provisions of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), as amended, the Final Dividend declared for the financial year 2013-14, which remained unclaimed for a period of seven years will be credited to the IEPFA on October 12, 2021. The corresponding shares on which dividend has not been claimed for seven consecutive years will also be transferred to IEPFA, as per the procedure set out in the aforesaid Rules.

Accordingly, the Company has sent individual communications at the latest available address to all the concerned shareholders whose shares are liable to be transferred to IEPFA during the financial year 2021-22 on account of unclaimed dividend amounts consecutively since 2013-14. The Company has also uploaded the full details of such shareholders and shares due for transfer to IEPFA on its website which can be accessed through web-link <https://www.kioclldt.in/user/cms/351>.

All the concerned shareholders holding shares in physical as well as demat form are required to make an application to the Company / Registrar by 25.09.2021 with a request for claiming the unpaid and unclaimed dividend for the financial year 2013-14 (Final) onwards, so that the shares and unpaid / unclaimed dividend are not transferred to the IEPFA.

It may please be noted that if no application is received by the Company / Registrar by 25.09.2021, the Company shall without any further notice, transfer the unpaid / unclaimed dividend along with corresponding shares to the IEPFA by the due date as per the procedure set out in the IEPF Rules and no claim shall lie against the Company in respect of the unpaid / unclaimed dividend along with corresponding shares transferred to IEPF pursuant to IEPF Rules.

Shareholders may note that the shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority after following the procedure given on its website i.e., <http://www.iepf.gov.in/IEPF/corporates.html>

For any queries on the above matter, shareholders are requested to contact the Registrar and Share Transfer Agent M/s. Integrated Registry Management Services Private Limited, No.30, Ramanna Residency, 4th Cross, Sampige Road, Malleshwaram, Bengaluru - 560 003. Tel: (080) 23460815-18, Fax: (080) 23460819, Email: irg@integratedindia.in.

For KIOCL LIMITED
Sd/-
(P.K Mishra)
Company Secretary

Place: Bengaluru
Date: 25.06.2021

InfoBeans
CREATING WOW!

INFOBEANS TECHNOLOGIES LIMITED
CIN: L72200MP2011PLC025622
Registered Office: Crystal IT Park, STP-1 2nd Floor, Ring Road, Indore - 452 001.
Telephone: 0731-7162102 | Email: compliance@infobeans.com | Website: www.infobeans.com
Contact Person: Ms. Surbhi Jain, Company Secretary and Compliance Officer.

POST-BUYBACK PUBLIC ANNOUNCEMENT FOR THE ATTENTION OF EQUITY SHAREHOLDERS / BENEFICIAL OWNERS OF EQUITY SHARES OF INFOBEANS TECHNOLOGIES LIMITED

This Post-Buyback Public Advertisement ("Post Buyback-PA") is being made in accordance with Regulation 24(w) and other applicable provisions of the Securities and Exchange Board of India (Buy-Back of Securities) Regulations, 2018 ("SEBI Buyback Regulations") for the time being in force including any statutory modifications and amendments from time to time regarding completion of the Buyback. This Post-Buyback-Public Announcement should be read in conjunction with the Public Announcement dated April 28, 2021 ("PA") and the Letter of Offer dated May 26, 2021 ("LoF"), issued in connection with the Buyback.

Unless specifically defined herein, capitalized terms and abbreviations used herein have the same meaning as ascribed to them in the Public Announcement and the Letter of Offer.

1. THE BUYBACK

1.1. InfoBeans Technologies Limited ("Company"/"ITL") had announced a buyback of 4,31,717 (Four Lakhs Thirty One Thousand Seven Hundred and Seventeen only) fully paid-up equity shares of face value of ₹ 10.00 each ("Equity Shares") of the Company ("Buyback") representing 1.80% of the Issued, Subscribed, Paid-up Equity Shares of the Company at a price of ₹ 232.00 (Rupees Two Hundred and Thirty Two only) per Equity Share, payable in cash, for an aggregate amount of ₹ 10,01,58,344 (Rupees Ten Crores One Lakh Fifty Eight Thousand Three Hundred And Forty Four only) ("Buyback Offer Size") from the Eligible Shareholders holding Equity Shares as on May 07, 2021 ("Record Date") excluding the Transaction Costs from all the existing shareholders / beneficial owners of Equity Shares, on a proportionate basis, through the Tender Offer method.

1.2. The Buyback Offer Size constituted 5.97% and 6.10% of the aggregate paid-up share capital and free reserves as per the audited standalone and consolidated financial statements of the Company for the financial year ended March 31, 2021 respectively, in accordance with section 68(2)(c) of the Companies Act, 2013 and the Buyback Regulations. The number of Equity Shares proposed to be bought back constituted 1.80% of the Pre-Buyback Equity Share Capital of the Company.

1.3. The Company adopted the tender offer method for the purpose of Buyback. The Buyback was implemented using the "Mechanism for acquisition of shares through Stock Exchange" notified by the Securities and Exchange Board of India vide its circular CIR / CF / POLICYCELL / 1 / 2015 dated April 13, 2015 read with circular no CFD/DCR2/CIR/P/2016/131 dated December 09, 2016. For the purposes of the Buyback, National Stock Exchange of India Limited ("NSE") was the designated stock exchange (DSE).

1.4. The Tendering Period for the Buyback Offer started on Tuesday, June 08, 2021 and ended on Monday, June 21, 2021.

2. DETAILS OF BUYBACK:

2.1. The Company received total 3 (Three) bids for 1,118 Equity Shares which were not valid since they were not shareholders on the Record Date i.e. May 07, 2021 and hence bids were rejected. Therefore, no Equity Shares were bought back in the Buyback Offer.

2.2. Since no Equity Shares were accepted in the Buyback Offer, therefore NIL amount was utilized for the Buyback.

2.3. The Registrar to the Buyback, Link Intime India Private Limited, considered a total of 3 invalid bids for 1,118 Equity Shares in response to the Buyback. The details of the bids received/considered by the Registrar to the Buyback are set out below.

Particulars	No. of Equity Shares reserved in Buyback	No. of Valid Bids	Total Valid Equity Shares Validly Tendered	% Response
Reserved category for Small Shareholders	64,758	Nil	Nil	N.A
General category of other Eligible Shareholders	3,66,959	Nil	Nil	N.A
Total	4,31,717	Nil	Nil	N.A

2.4. The communication of acceptance/rejection dated June 23, 2021 was sent by the Registrar to the Eligible Shareholders, on June 23, 2021 through ordinary post.

2.5. The unaccepted dematerialized Equity Shares were returned to respective Seller Member(s) / Custodian(s) by the Clearing Corporation on June 23, 2021. No Equity Shares were tendered in physical form.

2.6. None of the Equity Shares were extinguished since no Equity Shares were bought back in the Buyback Offer.

3. CAPITAL STRUCTURE AND SHAREHOLDING PATTERN:

3.1. The capital structure of the Company pre and post Buyback is as under:

Particulars	Pre-Buyback	Post Buyback
Authorized share capital	₹ 25,00,00,000 (2,45,00,000 Equity Shares)	₹ 25,00,00,000 (2,45,00,000 Equity Shares)
Issued Subscribed and Paid-up Equity Capital	24,01,56,000 (2,40,15,600 Equity Shares)	24,10,55,990* (2,41,05,599 Equity Shares)

*89,999 Equity Shares are allotted pursuant to ESOP in the Board Meeting held on April 26, 2021.

3.2. Details of the Eligible Shareholders from whom Equity Shares exceeding 1.00% of the total Equity Shares have been bought back under the Buyback are as mentioned below:

Sr. No	Name of the Shareholder	No. of Equity Shares accepted under Buyback	Equity Shares accepted as a % of total Equity Shares bought back	Equity Shares accepted as a % of total post Buyback Equity Share Capital of the Company*
Not Applicable				

3.3. The shareholding pattern of the Company, prior to the Buyback (as of the Record Date, being May 07, 2021) and post the completion of the Buyback is as follows:

Particulars	Pre Buy-back		Post Buy Back	
	Number of Equity Shares	% to the existing Equity Share Capital	Number of Equity Shares	% to the post-Buyback Equity Share Capital
Promoters and Persons Acting in Concert (Collectively "Promoters")	1,80,03,600	74.97%	1,80,03,600	74.69%
Foreign Investors (including Non Resident Indians / FIs / Foreign Mutual Funds / Foreign Nationals)	8,77,721	3.65%	8,77,721	3.64%
Financial Institutions / Banks & Mutual Funds promoted by Banks / Institutions and Insurance Companies	-	-	-	-
Others (Public, Public Bodies Corporate etc.)	51,34,279	21.38%	52,24,278*	21.67%
Total	2,40,15,600	100.00%	2,41,05,599	100.00%

*89,999 Equity Shares are allotted pursuant to ESOP in the Board Meeting held on April 26, 2021.

4. MANAGER TO THE BUYBACK OFFER

Sarthi Capital Advisors Private Limited
401, 4th Floor, Manek Plaza, 167, Vidyanagari Marg, Kalina, Santacruz (E), Mumbai - 400 098
Telephone: +91 22 2652 8671 / 72
Email: advisor@sarthiwm.in | Website: www.sarthiwm.in
Contact Person: Mr. Deepak Sharma
SEBI Registration No: INM000012011

5. DIRECTORS RESPONSIBILITY
As per Regulation 24(f)(a) of the SEBI Buyback Regulations, the Board of Directors of the Company accepts full responsibility for the information contained in this Post Buyback Public Announcement and confirms that the information included herein contains true, factual and material information and does not contain any misleading information.

For and on behalf of the Board of Directors of InfoBeans Technologies Limited

Sd/- Siddharth Sethi Managing Director	Sd/- Avinash Sethi Director & CFO	Sd/- Surbhi Jain Company Secretary & Compliance Officer
--	---	---

Date: June 25, 2021
Place: Indore

torrent POWER
TORRENT POWER LIMITED
Regd. Office: "Samanvay",
600, Tapovan, Ambawadi,
Ahmedabad - 380 015
(Gujarat), India
Phone: +91-79-2662 8300

CIN: L31200GJ2004PLC044068
Website: www.torrentpower.com
E-mail: es@torrentpower.com

NOTICE FOR DEDUCTION OF TAX ON FINAL DIVIDEND FOR FY 2020-21

NOTICE is hereby given that the Board of Directors of the Company at its meeting held on May 20, 2021 has recommended a Final Dividend of ₹ 5.50/- per equity share for the FY 2020-21 subject to approval of the Members' at the ensuing Annual General Meeting (AGM) of the Company. The Final Dividend, if declared by the Members', will be paid to the Members' holding equity shares of the Company as on the Record Date fixed by the Company for the purpose i.e. Friday, June 25, 2021.

Pursuant to the amendments introduced by the Finance Act, 2020, the Company will be required to Withhold Tax at the prescribed rates on the Dividend paid to its Members' w.e.f. April 01, 2020. No tax will be deducted on payment of Dividend to the resident individual Member, if the total Dividend received / to be received during the Financial Year does not exceed ₹ 5,000/-. Rate of Withholding Tax would vary depending upon the residential status of the member and documents registered with the Company.

The Members' are requested to refer the detailed communication including applicable Withholding Tax Rate for Resident and Non-Resident Members' alongwith required formats on the website of the Company www.torrentpower.com.

The Finance Act, 2021, has inter alia inserted the provisions of section 206AB of the Income Tax Act ("the Act") with effect from July 1, 2021. The provisions of section 206AB of the Act require the deductor to deduct tax at higher of the following rates from amount paid / credited to 'specified person':

- At twice the rate specified in the relevant provision of the Act; or
- At twice the rates or rates in force; or
- At the rate of 5.00%.

The 'specified person' means a person who has:

- not filed return of income for both of the two assessment years relevant to the two previous years immediately prior to the previous year in which tax is required to be deducted, for which the time limit of filing return of income under section 139 (1) of the Act has expired; and
- subjected to tax deduction / collection at source in aggregate amounting to ₹ 50,000 or more in each of such two immediate previous years.

The non-resident member who does not have the permanent establishment is excluded from the scope of a specified person.

Also, please note that:

- Members' are requested to ensure Aadhar number is linked with PAN, as per the timelines prescribed. In case of failure of linking Aadhar with PAN within the prescribed timelines, PAN shall be considered inoperative and, in such scenario, tax shall be deducted at higher rate of 20.00%.
- TDS to be deducted at higher rate in case of non-filers of Return of Income.

Primary Member can submit declaration as per Rule 37BA of the Income Tax Rules, 1962 to provide credit of TDS on dividend pay-outs by the Company, separately to the joint Members' (beneficiary Members') of the said shares on or before **July 01, 2021**. The said declaration received post **July 01, 2021** shall not be considered. The Company shall not be responsible for providing the TDS credit to the beneficiary Member, in any manner, in the absence of prior intimation by the primary Member to the Company.

The required documents viz. Form 15G / Form 15H / Form 10F, documents under Sections 196, 197A of the Income Tax Act, 1961, FPI Registration Certificate, Tax Residency Certificate, Lower Tax Certificate etc. can be uploaded on the link <https://web.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html> on or before **July 05, 2021** to enable the Company to determine the appropriate Tax Deductible at Source / Withholding Tax Rate. Any communication on the tax determination / deduction received post **July 05, 2021** shall not be considered by the Company / Registrar and Share Transfer Agent and Tax will be deducted on the applicable rate.

For Torrent Power Limited
Rahul Shah
Company Secretary

Place: Ahmedabad
Date: June 25, 2021

Government of Tamil Nadu
TINDIVANAM MUNICIPALITY
No: 2676 / 2016/E1
Date: 23.06.2021
REQUEST FOR QUALIFICATION (RFQ) - (6th CALL)

NOTICE INVITING REQUEST FOR QUALIFICATION (RFQ) for Construction of New Bus Stand in Tindivanam Municipality on Design, Build, Finance, Operate and Transfer ("DBFOT" basis of PPP)

Tindivanam Town known for its trading activities. The existing Bus stand of the Tindivanam Municipality was constructed around 47 years back with 10 bus bays as "C" class bus stand being operated at present to connect surrounding villages and towns. Considering the future growth of the town, Tindivanam Municipal Council approved the proposal to construct a new bus stand with 50 bus bays as "A" class bus stand with all required amenities in Municipality land situated along Tindivanam - Chennai GST Road at Ward-B, Block No. 10, T.S.No. 115 and Block No. 2, T.S.No. 286C (Old Survey No.334, 36/5) in Tindivanam.

*Request for Qualification (RFQ) is invited from Developers for construction of Bus Stand on Design, Build, Operate, Finance and Transfer (DBFOT) basis for a period of 22 years. Interested Developers may apply for the project based on their eligibility as per eligibility criteria mentioned in the RFQ document (para 34 to 38). The bidders should be single Business Entity incorporated as a Public/Private Limited Company, in incorporated under the Companies Act, 1956/2013. More details are provided in the RFQ document.

The eligible bidders shall be evaluated as per the qualifying criteria and become eligible to participate in the Request for Proposal (RFP).

The RFQ document can be obtained on payment of Rs. 10,000/- (Non refundable) from the Tindivanam Municipal office from 25.06.2021 to 27.07.2021 upto 3.00 p.m. RFQ document can also be downloaded from the following websites: www.tenders.in.gov.in and Tindivanam Municipal website: <https://www.turbantree.in.gov.in/tindivanam/between-25.06.2021-27.07.2021-upto-3.00-p.m>

The pre-proposal meeting is on 15.07.2021 at 11.00 am hrs. at Municipal Office, Tindivanam.

The duty filed-in and was sealed tender documents to be submitted online / offline method on or before 27.07.2021 upto 3.00 pm hrs.

Proposals will be opened on 27.07.2021 at 3.30 pm hrs at Municipal Office.

DIPR/1839/TENDER/2021
Commissioner, Tindivanam Municipality

